

કપાસની પોકેટ માર્ગદર્શિકા



કપાસની સાંઠીઓની વિવિધ બનાવટો અને ઉપયોગિતા



કપાસ સંશોધન કેન્દ્ર

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, મોતીલાગ, જૂનાગઢ-૩૬૨૦૦૧



- ◆ કપાસમાં ફ્રિપ અને મત્થીંગ
- ◆ કૃષિ વિસ્તરણ પ્રકાશન શ્રેષ્ઠી નં. ૩-૧-૪૮
- ◆ પ્રકાશન વર્ષ - ૨૦૧૬-૧૭ (પ્રથમ આવૃત્તિ)
- ◆ નકલ - ૨૦૦૦ નંગા

- ◆ સંપાદક
- ડૉ. એલ. કે. ઘડુક, સંશોધન વૈજ્ઞાનિક (કપાસ)
- ડૉ. વી. વી. રાજાણી, સંશોધન વૈજ્ઞાનિક (ખાનટ પેથોલોજી)
- ડૉ. જી. કે. કાતરીયા, સંશોધન વૈજ્ઞાનિક (ખાનટ ફિઝીયોલોજી)
- ડૉ. એમ. જી. વળુ, સહ સંશોધન વૈજ્ઞાનિક (ખાનટ ભ્રીડીંગ)
- પ્રો. આર. કે. વેકરીયા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (એન્ટોમોલોજી)
- પ્રો. વી. એલ. કિકાણી, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (એશ્રોનોમી)
- પ્રો. એમ. વી. વરીયા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (એન્ટોમોલોજી)
- શ્રી એ. આર. પટેલ, ખેતીવાડી અધિકારી
- કુ. કોમલ ડી. પટેલ, ખેતીવાડી અધિકારી

- ◆ મુદ્રક
- જ્યા ઓફસેટ, જૂનાગઢ.

કપાસની સાંઠીઓની વિવિધ બનાવટો

અને ઉપયોગિતા

વિશ્વમાં કુલ જમીનના 2.4 % ખેતીલાયક જમીન છે. યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ એગ્રીકલ્ચરના જણાવ્યા અનુસાર, વર્ષ 2014 અને 2015માં વિશ્વમાં કપાસના ટોચના ઉત્પાદકો ભારત, ચીન અને અમેરિકા છે જેમાંથી ભારત વાર્ષિક ૨૫ મિલિયન ટન કપાસનું ઉત્પાદન કરે છે. ભારતમાં કપાસનું વાવેતર જુલાઈથી સપ્ટેમ્બર માસ સુધીમાં અને લાણાણી જાન્યુઆરી માસ સુધીમાં કરવામાં આવે છે. ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્ર કપાસના ઉત્પાદન કરતા અગ્રેસર રાજ્યો છે જે કપાસના ઉત્પાદનમાં સંયુક્ત રીતે ૫૦% ફાળો આપે છે. કપાસના બીજમાંથી કપાસીયા તેલ તેમજ બાકી રહેલ સાંઠીઓને બળતણ તેમજ વિવિધ ઉપયોગમાં લેવામાં આવે છે.

હાલમાં મોટા ભાગના ખેડુતો કપાસની આ કીમતી સાંઠીને ખેતરમાંથી બહાર કાઢવાનો મજૂરી ખર્ચ અને સમય બચાવવાની ગેરસમજને કારણે ખેતરમાં સાંઠીને બાળી નાખે છે. જેથી જમીન તો સેન્ટ્રીય તત્ત્વાથી અલિપત રહે જ છે. તદઉપરાંત જે જગ્યાએ સાંઠીને બાળી નાખવામાં આવેલ હોય તે જગ્યાએ તેમજ તેની આસપાસ પણ ઘણું ઉચ્ચ તાપમાન પેદા થતું હોય જમીનમાં રહેલા ઉપયોગી સજીવો કે બેકટેરીયા તેમજ પોખકતત્વોનો નાશ થાય છે. પરીણામે તે જમીનમાં પણ બીજા વર્ષે પાક નબળો થાય છે. આ સંજોગોમાં કપાસની સાંઠીનું

બંધારણ તેમજ તેમાં રહેલા પોષકતત્વોની જાણકારી મેળવવી ખુબ જ જરૂરી છે.

કપાસની સાંઠીના બંધારણની વાત કરીએ ત્યારે પાક પોષકની પ્રાથમિક માહિતિની જાણકારી ખુબ જ જરૂરી છે. જમીન પર ઉગાડવામાં આવતા કોઈપણ પ્રકારના પાક જેવા કે ધાન્ય, તેલીબીયા, કદોળ, ફળ, ફુલ, વૃક્ષોનો વિકાસ પૂર્ણ કશાના ઉત્પાદન માટે કુલ ૨૦ પોષકતત્વો આવશ્યક છે. જે પુરતા અને સમતોલ જથ્થામાં પાકને મળવા અંત્યંત જરૂરી છે. તેની જરૂરીયાતની માત્રા અલગ અલગ હોય છે. જરૂરીયાતના જથ્થાના આધારે ત્રણ વિભાગ પાડવામાં આવે છે. મુખ્ય તત્વો નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ કે જેની પાકને વધુ જથ્થામાં જરૂર પડે છે. કેલિશ્યમ, મેળનેશિયમ અને ગંધક તત્વો સામાન્ય રીતે ખુબ જ અદ્ય જથ્થામાં જરૂરી છે અને પાક દવારા જમીનમાંથી અવશોષણ થતા હોય છે. આ ઉપરાંત કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સિજન કે જે ખુબ જ વધુ જથ્થામાં જરૂરી છે અને છોડ / પાકના બંધારણમાં ૮૫ થી ૮૨ સુધી રહેલા છે. કુદરતની મહેરથી આ ત્રણેય તત્વો પાણી અને હવામાંથી છોડ સીધા મેળવી શકે છે. કપાસના છોડના બંધારણમાં પોષકતત્વોની માત્રાની જાણકારી (કોડા—૧)માં દર્શાવેલ છે.

કોઠા-૧: કપાસના છોડમાં પોષક તત્ત્વોનું પ્રમાણ (ટકા) અને જમીન માંથી પાક દવારા થતું અવશોષણ

પોષક તત્ત્વો	કપાસના છોડમાં પોષક તત્ત્વોનું પ્રમાણ (ટકા)	કપાસ પાક દવારા પોષક તત્ત્વોનું જમીનમાંથી અવશોષણ
નાઈટ્રોજન	૨.૨ – ૨.૫	૧૦૦ થી ૧૫૦ (ક્ર./એકર)
ફોસ્ફરસ	૦.૩૧ – ૦.૪૬	૧૦ થી ૨૦ (ક્ર./એકર)
પોટાશ	૦.૫ – ૧.૨૫	૧૪૦ થી ૨૫૦ (ક્ર./એકર)
ક્રેલિયમ	૧.૨૫ – ૨.૨૫	–
મેનેશિયમ	૦.૧૫ – ૦.૩૦	–
સલ્ફર	૦.૧૮ – ૦.૪૦	૧૦ થી ૨૦ (ક્ર./એકર)
મેગેનીઝ	૩૦ – ૨૦૦ પીપીએમ	૨૫ થી ૧૦૦ (ગ્રામ/એકર)
લોહ	૪૦ – ૫૦૦ પીપીએમ	૨૦૦ થી ૮૦૦ (ગ્રામ/એકર)
જસત	૨૦ – ૪૦ પીપીએમ	૩૦ થી ૫૦ (ગ્રામ/એકર)
ક્રોપર	૧૧ – ૧૭ પીપીએમ	૧૫ થી ૨૫ (ગ્રામ/એકર)
બોરોન	૨૧.૮૦ પીપીએમ	૨૦ થી ૩૦ (ગ્રામ/એકર)
મોલીઝનમ	૦.૫ – ૦.૮૦ પીપીએમ	૫ થી ૧૦ (ગ્રામ/એકર)

જેડુત મિત્રોને એક વાત દ્યાનમાં બેસી ગઈ હશે કે જમીનમાંથી કપાસના પાક દવારા અવશોષિત થયેલ પોષકતત્ત્વોનું છોડના બધા ભાગો જેવા કે રૂ, કપાસ, પણ્ઠો, ડાળી વગેરે સંદર્ભમાં વહેચાયેલા હોય છે. કપાસ દવારા અવશોષિત થયેલ પોષકતત્ત્વોનો સામાન્ય રીતે અડઘો અડઘ જથ્થો સાંઠીમાં હોય છે. બજારમાંથી લાવીને ઉપયોગ કરેલ રાસાયણિક ખાતરની જ ગણતરી

કરીએ તો ખેડુતો એકરે આશરે હો. ૨૦૦૦–૨૫૦૦ નું ખાતર વાપરે છે. મતલબ કે આશરે હો. ૧૦૦૦–૧૨૦૦ નું ખાતર સાંઠીમાં હોય છે. ઉપરાંત સલ્ફર, પોટાશ, સુક્રમ તત્વો જેવા કે લોહ, જસ્ત, કોપર, મોલીઝેનમ, બોરોન અને છોડમાં રહેલી ૮૫ થી ૮૨ ટકા સેન્ટ્રીય (કાર્બન, હાઈડ્રોજન અને ઓકિસજન) તત્વોનો ડિસાબ બાકી રહે છે. તેની કિમત કરવાની કસરત કરવા ખેડુતભાઈઓને આહવાન છે.



ખોટી રીતે કુદરતી તત્ત્વો (કપાસની સાંઠી) નો નાશ ન કરીએ

કપાસની સાંઠીનો ઉપયોગ

- | | |
|--------------------------|-------------------------------|
| (૧) સેન્ટ્રીય ખાતર તરીકે | (૪) હાઈબોર્ડ/પેનલબોર્ડ બનાવવા |
| (૨) બળતણ તરીકે | (૫) પેપર બનાવવા |
| (૩) સફેદ કોલસા તરીકે | (૬) ફાઈબર બનાવવા |

કપાસની સાંઠીમાંથી ખાતર કઈ રીતે બનાવી શકાય ?

- સીધીજ સાંઠી ખાતરના ખાડામાં દબાવી ઘાસ, કચરો, માટીના થર બનાવી.
- પશુઓની કોઢ – (ગાઢી) માં દબાવી.
- ટ્રેકટર/ગાડાથી દબાવી ખાતરના ખાડામાં ભરી.
- ચાફ કટર (શ્રેડર) થી ટૂકડા કરી પશુની કોઢમાં પાથરી અથવા ખાતરના ખાડામાં દબાવી.

શ્રેડરના ઉપયોગ દવારા કપાસની સાંઠીમાંથી આધુનિક રીતે ખાતર કઈ રીતે બનાવી શકાય ?

- ખાડાનું માપ : $10 \times 6 \times 3'$
- સાંઠીના શ્રેડરથી કરેલા ટૂકડા (૭૭%)
- પશુઓના પેશાબવાળી માટી (૧૧%)
- તાજુછાણ (૧૧%)
- લાકડાની રાખ (૧%)



શ્રેડર ધ્વારા સાંઠીના ટુકડાની પ્રક્રિયા



સાંઠીનો ભુકો



ખાતરના ખાડામાં સાંકીના ટુકડાના થર કરવા



મારીનો થર કરી ખાતરનો ખાડો પેક કરવો

પદ્ધતિ

- તળીયું ભેજવાણું કરવું
- સાંકીના ટૂકડાનો થર કરવો (અઝોફુટ)
- સાથે પશુના પેશાબવાળી માટી અને છાણની રબડી થર પર છાંટવી (સ્યુડોમોનસ બેકટેરીયલ કલ્ચર ઉમેરવું)
- ત'ઈચ માટીનો થર કરવો
- ફરી સાંકીના ટૂકડાનો થર કરવો
- આમ થર કરતા જઈ ખાડાને દબાવતો જવો
- આખો ખાડો ભરાઈ જાય પછી ઉપર માટીનો થર કરવો
- ખાડામાં પાણી છાટતા જવું અથવા પાણી મુકવું
- ચાર માસમાં ખાતર તૈયાર થઈ જાય છે.
- તૈયાર થયેલ ખાતરને ખાડામાંથી બહાર કાઢી છાંચાવાળી જગ્યાએ રાખવું અને ખેતરમાં ઉમેરવું

ખાતર બનાવવા ઉપયોગી સુક્રમજીવાણુ

કૃગા:-

- એસ્પરજીલસ, ફ્યુઝેરીયમ અને ટ્રાયકોડર્મા

બેકટેરીયા:

- બેસીલસ, સ્યુડોમોનાસ, એક્ટોમોબેકટર અને વીણીયો ઓક્ટીનોમાયસેટ:
- સ્ટ્રેપ્ટોમાયસીસ અને નોકર્ડિયા

આ ઉપરાંત અવિકતમ પાક ઉત્પાદન અને મહત્વમ આર્થિક વળતર મેળવવા માટે તેમજ જમીનની તંદુરસ્તી લાંબો સમય જાળવવાના સહીયારા પ્રયાસ માટે સાંઠીનો બે રીતે ઉપયોગ કરી શકીશું.

(૧) રોટાવેટર દ્વારા ખેડ કરી જમીનમાં દલાવવી:

રોટાવેટર ખેતી માટે ખુબ જ અગત્યનું ખેત ઓજાર છે અને વાવેતર માટે જમીન તૈયાર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. કપાસની વીજી પછી પિયતની સગવડ હોય, રેતાળ, ગોરાડુ જમીન હોય તો રોટાવેટર દવારા ઉભા કપાસમાં ખેડ કરવાથી કપાસની સાંઠીના નાના નાના ટુકડા થઈ જમીનમાં મિશ્રણ થઈ જાય છે. આ ઉપરાંત હાર્વેસ્ટરથી ઘઉની કાપણી કર્યાબાદ રોટાવેટરનો ઉપયોગ કરીને ખેડની સાથોસાથ ઘઉના ભાઠાના નાના નાના ટુકડા થઈ જમીનમાં મિશ્રણ કરી સેન્ટ્રીય તત્વોનો વધારો કરી શકાય છે. આવુ કરવાથી જમીનની બૈતિક સ્થિતિ સુધરીને ખુબ જ ભરભરી અને ફણદુધ બની જાય છે.

રોટાવેટર હાલમાં જુદી જુદી સાઈઝમાં જેવી કે ૪ ફુટ, ૫ ફુટ વગેરેમાં ઉપલબ્ધ છે. જેને ઉપ તથા પપ હોર્સ પાવરના ટ્રેકટર દવારા ઉપયોગમાં લઈ શકાય છે.

(૨) કમ્પોસ્ટ ખાતર બનાવવું: સચોટ ઉપાય

કપાસની સાંઠી ખેતરમાંથી ઉપાડી ટ્રેકટર / ઇલેક્ટ્રિક મોટર સંચાલીત કટર (કોટન સ્ટોક શેડર)થી ખુબ જ નાના નાના ટુકડા કરી વેશાનિક રીતે ખાડામાં વ્યવસ્થિત રીતે પાથરી તેમાં થોડા છાણની

રબડીનો છંટકાવ કરી તથા સાંઠીની સરવાની પ્રક્રિયા ઝડપથી કરવા અને તેનું વિધટન કરી સારી ગુણવત્તાવાળું ખાતર બનાવવા માટે સીલાઈટીક બેકટેરીયા એક ટન સાંઠી દીઠ એક કિલો પ્રમાણો તેનું ૨૦૦ લીટર પાણીમાં દ્રાવણ બનાવી ટુકડાના થર ઉપર છંટકાવ કરી અને છેલ્લે આ ખાડાને ટાંચ અથવા માટીથી ઢાંકી હવાચુસ્ત કરીને તેના ઉપર પાણીનો વ્યવસ્થિત રીતે પલાળવું. ત્યાર બાદ તેજ સ્થિતીમાં રાખવું. અને એકાદ માસ બાદ તેને વ્યવસ્થિત રીતે ફેરવવું તથા જૈવિક કલ્યાર ઉમેરવું. લગતભગ નણોક માસમાં તેમાંથી એકદમ ગળતીયું તથા બધા જત્ત્વોથી સભર ખાતર તૈયાર થઈ જાય છે.



સાંઠીનો ખેતરમાં સીલાઈજ રોટાવેટર દવારા ઉપયોગ



યાંત્રિક સાધનનો ઉપયોગ ધ્વારા સાંઠીના ટુકડાનું એકગીકરણ

સેન્ટ્રીય ખાતર બનાવવાથી થતા ફાયદાઓ:

- કપાસની સાંઠીમાંથી સેન્ટ્રીય ખાતર બનાવવાથી જમીનમાં કાર્બન (૮૭.૩૧%), નાઈટ્રોજન (૦.૮૮%), ફોસ્ફરસ (૦.૧૫%), પોટાશ (૦.૪૫%) અને સલ્ફર (૦.૨૧%) તત્વોનો ઉમેરો થાય છે.
- જેથી જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક સ્થિતી સુધરે છે.
- રાસાયણિક ખાતરોની ક્ષમતા વધારી શકાય છે.

એહુત મિન્ટો જો આપણે આવી રીતે કપાસની સાંઠી બાળવાનું બંધ કરી ઉપર મુજબની પદ્ધતિ પ્રમાણે સેન્ટ્રીય ખાતર બનાવી જમીનમાં ઉમેરીએ તો આપણે લાંબા સમય સુધી જમીનની ફળદુપતા ટકાવી આપણા વંશજોને ઉપજાંબું જમીન વારસામાં આપી શકીશું.

અધતન તકનિકોના થયેલ વિકાસમાં, વુડ પેલેટ મિલમાં કપાસની સાંઠીઓને ટીકડીઓમાં રૂપાંતરિત કરવામાં આવે છે તેમજ લાકડાના પાટીયા (શીટો) બનાવવામાં આવે છે. ઉઘોગોમાં કપાસનો ઉપયોગ મુખ્ય કાચા ભાલ તરીકે થાય છે.

સ્પર્ધાના યુગમાં ખેડૂતોને આર્થિક રીતે પરવડે તેમજ આવકમાં વધારો થાય, ગામડાઓમાં નાના ઉઘોગોની સ્થાપના કરવાની તકો મળી રહે તેમ જ યુવાનોને રોજગારીની તકો મળી રહે, બનાવતમાં સરળ, સંગ્રહ કરી શકાય એવી અને જરૂર પડયે જૈવિક બળતણ તરીકે ઉપયોગમાં લઈ શકાય તે માટે કપાસની સાંઠીઓની ટીકડીઓ (પેલેટ) બનાવવાની તેમજ ફર્નિચર, ફોલ્સ સીલિંગ, પાર્ટીશન તેમજ પેનલો વગેરે બનાવવા માટે ઉપયોગી લાકડાના પાટીયા (શીટો) બનાવવાની તદ્દન સરળ પ્રક્રિયા અતે વર્ઝાવેલ છે.

કપાસની ટીકડીઓ:

કપાસની સાંઠીઓ વિષે માહિતી:

કપાસની મોટાભાગની સાંઠીઓમાંથી અમુક ભાગ જ બળતણ તરીકે વપરાય છે બાકીની નકામાં કચરા તરીકે ફેકી દેવામાં આવે છે અથવા ખેતરમાં સણગાવી નાશ કરવામાં આવે છે. પાકની જાતો અને પરિસ્થિતિને આધારિત કપાસની સાંઠીઓ જુદી જુદી લંબાઈ અને વ્યાસની હોય છે. આ સાંઠીઓમાં સરેરાશ ફેમિસેલ્વુલોઝ, ૨૫% લીનીન અને ૭% એશનું પ્રમાણ હોય છે. બીજા પાકોની સરખામણીમાં વધુ રેસાયુક્ત અને વધુ ઉભીય શક્તિ (લગભગ ૧૭.૪૦ મેગા જુલા/કિલોગ્રામ) હોવાથી તે બળતણ માટે ઉપયોગી છે.

કપાસની સાંઠીઓની ગુણવત્તા:

- બેજનું પ્રમાણ : ૨૦% (ડ્રાઇ બેસીસ)
- સરેરાશ ઘનતા : સરેરાશ ઘનતા વધુ (૫૦૦ કિગ્રા./મીટર^૩) હોવાથી હેરફેરમાં સરળતા રહેછે.
- વ્યાસ : ૫૦ મિલિમીટર
- ઉષ્ણીયતા : ખૂબ જ વધુ (૩૭૦૦ કિલોક્રેન્ટરી/કિગ્રા) છે.
- સુક્ષ્મકષ્ણોનું બળતણ થાય ત્યારે કાર્બન ડાયોક્સાઈડ ઉત્પન્ન કરતી ન હોવાથી પ્રદૂષણ નહિવત થાય છે.
- કિમતમાં ખૂબ જ સસ્તી હોય છે.

કપાસની સાંઠીઓમાંથી ટીકડીઓ (પેલેટ) બનાવવાની પ્રક્રિયા:

ટીકડીઓની (પેલેટ) ખૂબ જ જરૂરિયાત હોવા છતાં નાના પાયાનું ઉત્પાદન કરતા સાધનો ઉપલબ્ધ છે. કપાસની સાંઠીઓમાંથી ટીકડીઓ બનાવવાની પ્રક્રિયામાં ભૂક્કો કરવો, સૂક્વણી, ટીકડી બનાવવી, ઢંડી કરવી, ચાળવી અને પેકીંગ કરવાની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.

ટીકડીઓનો ઉપયોગ:

- ચીમનીઓમાં બળતણ તરીકે વપરાય છે,
- બોઇલરમાં બળતણ તરીકે વપરાય છે,
- પરંપરાગત રીતે વપરાતા ચુલાઓમાં બળતણ તરીકે ઉપયોગી છે.

લાકડાના પાટીયા (Sheet) બનાવવાની રીત અને વિવિધ ઉપયોગો:

સૌ પ્રથમ કપાસની સાંઠીઓની ૧.૫ થી ૨.૦ સેન્ટીમીટરની નાની પટીઓ (ચીપ્સ) બનાવવામાં આવે છે. આ પટીઓને ૨૦ થી ૮ મેશની ચાળણીથી ફરીથી નાના કદની પટીઓમાં રૂપાંતરિત કરવામાં આવે છે. ત્યારબાદ નાની પટીઓ (ચીપ્સ)ને યુરિયા ફોર્મલિફ્ટાઇડ સાથે ભેણવી ઉપર અને નીચેનો ભાગ બનાવવામાં આવે છે. આખરે, પાણીની વરાળના દબાણણી યોગ્ય કદ તેમજ આકારના બીબામાં ઢાળી ચોક્કસ સમય માટે દબાણ આપી પાટિયા બનાવી તેમના પરિમાણમાં ફેરફાર ન થાય તે માટે ઠંડા કરી યોગ્ય કદમાં કાપવામાં આવે છે. જુદા જુદા રસાયણો તેમજ ગુણવર્ધકો ઉમેરી આ પાટિયાઓ (શીટો) ને પાણી, અનિન તેમજ ઉદ્ઘટ સામે ટકાઉ બનાવી શકાય છે. પાટિયાઓ (શીટો) બ્યુરો ઓફ ઈન્ડીયન સ્ટાન્ડર્ડના (બી.આઈ.એસ.) નક્કી થયેલ ઘારાધોરણને મળતા હોવાથી ફર્નિચર બનાવવા, ફોલ્સ સીલિંગ, પાર્ટિશન તેમજ પેનલો વગેરે બનાવવા માટે ઉપયોગી છે. કાચા માલની તેમજ ડિયાશક્કિતની ઓછી જરૂરિયાત હોવાથી લાકડામાંથી બનાવેલ પાટિયા (શીટો) કરતા કપાસની સાંઠીઓમાંથી બનાવેલ પાટિયા (શીટો)ની કિંમત ઓછી છે.

કેવી પરિસ્થિતિમાં સાંઠીઓને બાળવી જોઈએ:

આમ તો ખાસ કરીને સાંઠીઓને બાળવાની ભલામણ કરવામાં આવતી નથી પરંતુ તેમાંથી વિવિધ બનાવવટો બનાવવાની ભલામણ થાય છે પરંતુ જ્યારે ગુલાબી ઈયણનો જે તે સીજનમાં અને એમાય ખાસ કરીને છેલ્લી અવસ્થામાં વધુ ઉપદ્રવ જણાયેલ હોય ત્યારે

તેની છેલ્લી અવસ્થાની ઈયળો / કોશેટાઓ નુકશાન કરેલા
જીડવાઓમાં, કાલાઓમાં અથવા ખરી પડેલા કપાસના રૂ /
અવશેષોમાં સુખુપ્ત અવસ્થામાં રહે છે, અને જ્યારે ફરીથી કપાસની
નવી સીજન ચાલુ થાય અને હુલ અવસ્થા આવવાની શરૂઆત થાય ત્યારે
ગુલાબી ઈયળની છેલ્લી અવસ્થાની ઈયળો / કોશેટાઓ પુખ્ત હુદાઓ
બની અને ઈડા મુકે છે અને ફરીથી ઉપદ્રવ જોવા મળે છે. આમ, એકંદરે
જોઈએ તો સંગ્રહિત કરેલ સાંઠીઓજ તેમનો રહેવા અને જીવવા માટેનો
મુખ્ય સ્ત્રોત અને આશ્રયસ્થાન બની રહે છે. આવી જ પરિસ્થિતિ
ખરીફ—૨૦૧૫ માં નિર્માણ થયેલી અને એ વખતે બેડૂતોને કપાસની
સાંઠીઓને શેદ્ધાપાળા, ખેતરમાં કે અન્ય કોઈ જગ્યાએ સંગ્રહીત નહીં
કરવાને બદલે બાળીને નાશ કરવાની ભલામણ કરવામાં આવી હતી.

ઉપયોગી ટેલીફોન નંબર

નામ

મોબાઇલ નં



પ્રાપ્તિસ્થાન

કપાસ સંશોધન કેન્દ્ર, જુ.કૃ.યુ. જૂનાગઢ.

ફોન : ૦૨૮૫-૨૬૭૪૯૫૦